

Shashijit Infraprojects Limited
Construction Engineers

T : +91 260 2432963, 78786 60609
E : info@shashijitinfraprojects.com
W : www.shashijitinfraprojects.com

6th September, 2020

To,
The Department of Corporate Services,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai-400001

Scrip Code : 540147
Security ID : SHASHIJIT

Subject : Newspapers clippings – Notice of 13th Annual General Meeting
along with instructions for updating E-Mail IDs and other related
matters.

Reg. : MCA Circular No. 20/2020 dated 5th May 2020

Dear Sir/Madam,

As per MCA Circular No. 20/2020 dated 5th May, 2020, please find attached herewith copy
of Newspaper Advertisement for the Notice of 13th Annual General Meeting along with
instructions for updating E-Mail IDs and other related matters.

The Advertisement published in "GUJARAT MITRA TIMES" (Gujarati Newspaper) and in
"FREE PRESS JOURNAL" (English Newspaper) dated 6th September, 2020.

Kindly take the same in your record.

Thanking you.

Yours Faithfully,
For SHASHIJIT INFRAPROJECTS LIMITED.


(MANTHAN D. SHAH)
Company Secretary
& Compliance Officer
M. No. A42509



Encl. As above

ગણદેવીના પરિવારના ૫ મૃતકની સ્મશાનયાત્રા નીકળતાં લોકોનું આક્રંદ



વલસાડ નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં દંપતી તેમજ તેમનાં ત્રણ સંતાનોના કટુણ મોત થયાં હતાં

ધનોરી નાકા (ગણદેવી): વલસાડ નેશનલ હાઇવે ઉપર શુક્રવારે ગણદેવીના એક જ પરિવારના ૫ સભ્ય માતા-પિતા અને ત્રણ સંતાનને નહેલા માર્ગ અકસ્માતમાં પાંચેયનાં કટુણ મૃત્યુ થતાં ગણદેવીમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃત્યુ પામનાર અજય દલપત, પત્ની



રેખા તથા સંતાનો કન્યા, નેસી, જૈનમની અર્ધી શનિવારે ગણદેવી પશુ દવાખાના પાસેના હરિજનવાસ ખાતે લવાતાં લોકોમાં હેયા ફાટી જાય તેવાં કુણાદાયક દશ્યો સર્જાયાં હતાં. સાંજે ૪-૪૫ કલાકે આ પાંચ વ્યક્તિના પરિવારની સ્મશાનયાત્રા એકસાથે નીકળી હતી.

પૂરી કરી શનિવારે બપોરે ગણદેવી ખાતે મૃતદેહો લવાયા હતા. અંતિમયાત્રામાં ધારાસભ્ય નરેશ પટેલ, ગણદેવીના નગરપતિ રમણ પટેલ, ઉપ નગરપતિ નિલેશ ગોઝલે, ગોપાલ ગોહિલ, કોર્પોરેટરો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સદગત આત્માઓને અંતિમ વિદાય આપી હતી.

નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો, ૯ કેસ નોંધાયા

કોરોના પોઝિટિવનો આંકડો ૯૫૩ થયો, હાલ ૮૬ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

નવસારી, વાંસદા : નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં શનિવારે ઘટાડો થતાં નવા ૯ કેસો કોરોના પોઝિટિવના નોંધાયા છે. નવસારી જિલ્લામાં કોવિડનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ કેસો સામે આવવાની શક્યતા હતી. પરંતુ હાલ જિલ્લામાં સરેરાશ રોજના ૧૦ કેસની આસપાસ મળી રહ્યા છે. શનિવારે પણ જિલ્લામાં ૯ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. જેમાં ચીખલી તાલુકામાં ૨, જલાલપોરમાં ૨, વાંસદા તાલુકામાં ૨, વિજલપોરમાં ૧, નવસારીમાં ૧

ચીખલીમાં એક આરોગ્ય કર્મચારી સહિત બે કોરોના પોઝિટિવ

લેજ: ચીખલી તાલુકામાં એક આરોગ્ય કર્મચારી સહિત બે કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચીખલીના હોન્ડ પીએચસીમાં એમપીએચડીએ વિજલપોર-૧, નવસારી-૧, ખેરગામ-૧ તરીકે ફરજ બજાવતા ચિમલ અમલભાઈ પટેલ (ઉ.વ.૩૯) (રહે., વંકાલ, તા.ચીખલી)નો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તેમને નવસારી સ્થિત કોવિડ કેર સેન્ટરમાં ખસેડાયા હતા અને તેમના સંપર્કમાં આવતા ૧૨ જેટલાને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. આ ઉપરાંત સુરેશ નામદાર પવાર (ઉ.વ.૩૦)ને શરદી તાવની તકલીફ જણાતાં સીએચસીમાં સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે, આ દર્દીનું રહેઠાણ સહિત વિસ્તારમાં હોવાથી ત્યાં ખસેડાઈ હોવાનું જણાવ્યું હતું.

અને ખેરગામ તાલુકામાં ૧ કેસ નોંધાયા હતા. જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૯૫૩ પર પહોંચ્યો છે. બીજી તરફ શનિવારે વધુ ૯ દર્દીએ કોરોનાને માત

આપતાં જિલ્લામાં કુલ ૭૭૪ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. જો કે, શનિવારે એકપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. હાલ જિલ્લામાં કુલ ૮૬ કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વલસાડમાં ઓનલાઈન ઠગાઈના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિ ઠગાયા

વલસાડમાં વેપારી, પંચરની દુકાન ચલાવનાર અને ફેરિયાને ફોન કરી ઠગો કરામત કરી ગયા

વલસાડ: વલસાડના રામજી ટેકરા ભરત કુટિર ડી-૨૦માં રહેતાં ધીરેન કિરીટ પંચમતિયા ખત્રીવાડમાં ન્યૂ થેતા ફેશનવેર દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૨૯/૦૭/૨૦ના રોજ ધીરેનના મોબાઈલ પર કોલ આવ્યો હતો કે, બેન્કમાંથી બોલું છે, તમારે બેન્ક એકાઉન્ટ અપડેટ કરવા માટે તમારા મોબાઈલ પર લિંક મોકલી છે, તે લિંક ઓપન કરવા જણાવ્યું હતું. જેથી ધીરેનભાઈ પોતાના મોબાઈલમાં લિંક ઓપન કરતાંની સાથે સામેવાળાનો ફોન કટ થઈ ગયો હતો. ત્યારબાદ ધીરેનના મોબાઈલ પર એક પછી એક કરીને ૧૧ વાર ટ્રાન્ઝેક્શન કરી વલસાડ ક્રોટક મહિન્દ્રા બેન્ક શાખામાંથી રૂ.૧,૧૯,૯૦૦ ઉપડી ગયા હતા. જેથી ધીરેનભાઈ તાત્કાલિક

બેન્કમાં જઈને પોતાનું બેન્ક એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું. અન્ય બનાવમાં વલસાડ નજીક પારનેરા લીમડાચોક પાસે રહેતો જીવેદ આલમ પારનેરામાં પંચરની દુકાન ચલાવે છે. ગતરોજ જીવેદના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો કે તમારી ડ્રોમાં ફૂપન લાગી છે. રૂ.૩૫૯૯૦ એટલે તમે તમારા બેન્ક એકાઉન્ટ અથવા ગુગલ પે ઓટીપી નંબર આપો કહી ઓટીપી નંબર આપતાની સાથે જ બે કલાકની અંદર તેના વલસાડ બીઓબી બેંકના એકાઉન્ટમાંથી રૂ.૭૪,૦૦૦ ઉપડી ગયા હતા. જેથી જીવેદે તાત્કાલિક બેન્કમાં જઈને પોતાનું બેન્ક એકાઉન્ટ બંધ કરાવ્યું હતું. ત્રીજા બનાવમાં વલસાડના તિથલ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મહાદેવ રવિશંકર સિંહ પેપર નાખીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના મોબાઈલ પર ફોન આવ્યો હતો કે, તેઓ ફોન પર વાત કરતાં કરતાં એના એકાઉન્ટમાંથી રૂ.૨૮૯૯૯ ઉપડી ગયા હતા. જેથી ધીરેનભાઈ તાત્કાલિક

કોવિડના નિયમોના પાલનમાં ક્ષતિ જણાતાં ડુંગરીની વૈદ્ય હોસ્પિટલ ૭ દિવસ માટે બંધ

નાયબ કલેક્ટરની ફલાઈંગ સ્કવોડની તપાસ બાદ આરોગ્ય અધિકારીએ હોસ્પિટલ બંધ કરવાનો આદેશ કર્યો

ખાનગી હોસ્પિટલોમાં કોવિડના નિયમોના પાલન અંગે આકસ્મિક તપાસ

વલસાડ: વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા અને કવિષ્ પગલાં લઈ રહ્યા છે. જેના ફળદાયી પરિણામો પણ મળ્યાં છે. ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર જયોતિબા ગોહિલની આગેવાનીમાં ફ્લાઈંગ સ્કવોડ દ્વારા જિલ્લાની ખાનગી

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પગલાં લેવા આવશ્યક છે: ડો.અનિલ પટેલ


જિલ્લાના સીડીએચઓ ડો.અનિલ પટેલે જણાવ્યું કે, કલેક્ટર દ્વારા બનાવાયેલી ફ્લાઈંગ સ્કવોડ દ્વારા આકસ્મિક તપાસમાં વલસાડની લોડ્સ હોસ્પિટલ, કસ્ટુરબા હોસ્પિટલ અને વાપીની જીવનદીપ હોસ્પિટલને પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સહિત યુદ્ધે શો કોઝ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. જ્યારે ડુંગરી વેદ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી માટે ૭ દિવસ હોસ્પિટલ બંધ કરાઈ છે. હોસ્પિટલોનો સ્ટાફમાં પણ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પગલાં લેવા આવશ્યક છે તેમ ઉમેર્યું હતું.

હોસ્પિટલોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કોવિડ-૧૯ના નિયમોના પાલન બાબતે ભૂલિઓ જણાતાં હોસ્પિટલો સામે શો-કોઝ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. ડુંગરી સ્થિત વેદ હોસ્પિટલમાં ગંભીર ભૂલિઓ અને અનિયમિતતા જણાતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી ૭ (સાત) દિવસ માટે હોસ્પિટલને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

તો વલસાડની કસ્ટુરબા હોસ્પિટલ, લોડ્સ હોસ્પિટલ અને વાપીની જીવનદીપ હોસ્પિટલને પણ સોશિયલ ડિસ્ટન્સનો અમલ ન કરવા મુદ્દે શો કોઝ નોટિસ આરોગ્ય વિભાગે પાઠવી છે. આવનારા સમયમાં આ ડ્રાઈવ થાલુ રહેશે અને ખાનગી હોસ્પિટલોની ભૂલિઓ બાબતે રજુઆત આવશે તો ગંભીરતાથી લેવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર વલસાડ દ્વારા જણાવ્યું છે.

વાંસદામાં ગેરકાયદે એક્સપ્લોસિવના જથ્થા સાથે ત્રણ આરોપીની અટકાયત

નવસારી : વાંસદામાંથી ગેરકાયદે એક્સપ્લોસિવના જથ્થા સાથે અને નવસારી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ નવસારી સ્પેશિયલ ઓપરેશન યુપ પોલીસે ખાતમીના આધારે વાંસદાના કંબોયા બસ સ્ટોપ પાસેથી વાંસદાના કંબોયા તળાવ ફળિયામાં રહેતા પરિમલભાઈ ઉમેશભાઈ પટેલ (ઉ.વ.૩૦) પાસેથી એક કાપડની થેલીમાંથી ૨૫૦ રૂપિયાની ગેરકાયદે એક્સપ્લોસિવ જિલ્લીન સ્ટિક ૫ નંગ, ૫૦ રૂપિયાના ઓડીનરી ડિટોનેટર ૫ નંગ અને ૩ હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ ૩૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે પરિમલભાઈ સાથે વાંસદા તાલુકાના લીમ્બપડા ગામે ડુંગરી ફળિયામાં રહેતા દિલીપભાઈ વસંતભાઈ પટેલ અને ભરતભાઈ ઉડકભાઈ પટેલને પણ ઝડપી પાડી આગળની વધુ તપાસ અર્થે વાંસદા પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે.



સુરક્ષા મહિનાની ઉજવણીના ભાગરૂપે અને કર્મચારીઓમાં જગૃતતા લાવવા માટે પિડીલાઈટ ઈન્સ્ટ્રીક્ટ લિ. પ્લોટ નં.૨૩, વાપી દ્વારા સલકચુરીક એસીડના રિસાવને અટકાવવા તેમજ તે માટે સુરક્ષિતતાના પગલા લેવા માટે મોકડીલ નું સફળ આયોજન તા.૩૧/૦૮/૨૦૨૦ના રોજ રાત્રિના ૧૧.૫૫ કલાકે કરવામાં આવેલ હતું.

સ્વચ્છતા અભિયાનના સરકારી કચેરીઓમાં જ ધજાગરા

વલસાડ આરટીઓના બંધ ટોઈલેટમાં દૂષિત પાણી ભરાતાં પારાવાર દુર્ગંધ

ગ્રાઉન્ડ ફ્લોર પર તૂટેલા ફર્નિચરના ખડકલા દૂર કરવા આવશ્યક

વલસાડ: વલસાડ જિલ્લાની આરટીઓ કચેરીના ભોંયતળિયે આવેલા જેન્ટ્રસ ટોઈલેટમાં ગંદકી, ભરાયેલાં પાણી, તૂટેલા ફર્નિચરના ખડકલાને લઈ દુર્ગંધનું વાતાવરણ ફેલાયું છે. જેથી આવનારા અરજદારોમાં નારાજગી સાથે આકોશ ફેલાયો છે. છતાં કચેરીના અધિકારીઓ નિષ્ક્રિય રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલી આરટીઓ કચેરીમાં વલસાડ જિલ્લામાંથી પ્રતિદિન અસંખ્ય લોકો વાહનોનાં વિવિધ કામ માટે આવે છે. જો કે, હાલે કોરોનાની મહામારી વચ્ચે પણ કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા અને બંધ કરી દેવાયેલા જેન્ટ્રસ ટોઈલેટમાં કેટલાય દિવસથી પાણી ભરાયું છે. જેનો નિકાલ ન થતાં ગંદકી સાથે દૂષિત



વાતાવરણ ફેલાયું છે. અહીં તૂટેલી ખુરશીઓનો ખડકલો કરાયો છે. ટોઈલેટ બંધ જ હોય તો તેને તોડી નાંખવું જોઈએ અથવા પાણી ન ભરાય તેનું આયોજન કરવું જોઈએ,

એવું અરજદારોનું કહેવું છે. આ ગંભીર સમસ્યા મુદ્દે કોઈ કામગીરી ન થતાં કચેરીમાં આવતા અરજદારો અને મુલાકાતીઓમાં આકોશ જોવા મળી રહ્યો છે.

સંક્ષિપ્ત સમાચાર

નવસારી જિલ્લામાં ચાર શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા



નવસારી: તા.૬મી સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડો.રાધાકૃષ્ણ સર્વવલ્લીનો જન્મદિવસ પણ છે તેમની યાદમાં મનાવવામાં આવે છે. નવસારીના ભક્તાશ્રમ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિલોધિક સન્માન સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે જિલ્લાના ચાર શ્રેષ્ઠ શિક્ષકો વિમલ સોલંકી, નિતિનભાઈ પાઠક, મીનાક્ષીબેન પટેલ અને દક્ષાબેન પટેલનું પ્રશસ્તિપત્ર, રોકડ ધનામ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પ્રારંભમાં જિલ્લા પ્રાથમિક અધિકારી આર.એમ.ચોધરીએ મહેમાનોને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભક્તાશ્રમના નીરવભાઈ, ધર્મેશ કાપડિયા, અશોકભાઈ, ભાસ્કરભાઈ, શિક્ષકો-શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખેરગામમાં વીજસામાન ચોરી કેસમાં સંડોવાયેલા ૪ ઝડપાયા, ૩ પોલીસ પકડથી દૂર

ખેરગામ: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બે કોન્ટ્રાક્ટરો દ્વારા વીજળી કચડાનો માલ સામાન વેચી મારવાના પ્રકરણમાં ખેરગામ



પોલીસ દ્વારા બંને કોન્ટ્રાક્ટર સહિત સાત જેટલા ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શનિવારે ખેરગામ પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા ભૂનંદર સમરત (રહે., નડગઢરી, દેસાઈ ફળિયા), સતીષ દેશમુખ નડગઢરી તેમજ વિમલ નામના ઈસમ અને કોન્ટ્રાક્ટર દર્શન ગાયકવાડની ધરપકડ કરાઈ હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટર સુભાષ ગાયકવાડ સહિત ૩ ઈસમ પોલીસ પકડથી દૂર છે. ખેરગામ તથા રૂમલા પેટા વિભાગીય કચેરીના કોન્ટ્રાક્ટર દર્શન ગાયકવાડ (રહે., નડગઢરી, દેસાઈ ફળિયા) અને સુભાષ ગાયકવાડના મટિરિયલ હિસાબમાં આઠ લાખથી વધુની કિંમતના માલસામાનની ઘટ આવાતાં ફરિયાદ થઈ હતી.

વાપી-વલસાડમાં ગરમીનો પારો ૩૪ ડિગ્રીએ પહોંચતાં લોકો પરેશાન થઈ ગયા

વાપી: વલસાડ જિલ્લામાં બે-ત્રણ દિવસથી સતત વાતાવરણમાં ગરમી અને ઉકળાટ જોવા મળી રહ્યા છે. ગુરુવારે વલસાડ-વાપીમાં ગરમીનો પારો ૩૦.૫ નોંધાયો હતો. જ્યારે શુક્રવારે તેમાં એકાએક પાંચ ડિગ્રીનો ઉછાળો આવતાં મહત્તમ તાપમાન ૩૫.૫ પર પહોંચી ગયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૫ પર સીમિત રહ્યું હતું. જ્યારે શનિવારે મહત્તમ ૩૫.૫ અને લઘુત્તમ તાપમાન ૨૭ રહેતાં અસહ્ય ઉકળાટ અને બકારાની સાથે લોકો ગરમીથી ત્રાસી ગયા હતા. હવામાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા નોંધાતાં લોકો પરસેવે રેગરેગે બંધ ગયા હતા.

વલસાડના સોનવાડા હાઇવે ઉપર અકસ્માતમાં એકનું મોત

વલસાડ: વલસાડ નજીક ડુંગરી સોનવાડા હાઇવે ઉપર અકસ્માતમાં મોપેડ ચાલાકનું મોત નિપજ્યું હતું. જે અંગેની ફરિયાદ નોંધાઈ છે. નવસારીના પંચવટી સોસાયટી રહેતા વલ્લભભાઈ રત્નાભાઈ લાહીયા (ઉ.વ.૬૬) નવસારીમાં સોના-ચાંદીની દુકાનમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ વલ્લભભાઈ પોતાની મોપેડ લઈ કામ અંગે નવસારીથી વલસાડ જવા માટે નીકળ્યા હતા. ડુંગરી સોનવાડા પેટ્રોલ પંપ પાસે નેહા નં.૪૮ સુરતથી મુંબઈ તરફ જતા રોડ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવેલી કારના ચાલકે કાર પૂરઝડપે હંકારી સાથે મોપેડ સાથે અકસ્માત સર્જાઈ હતો. જેમાં મોપેડ ચાલક વલ્લભભાઈને ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે અંગેની ફરિયાદ ડુંગરી પોલીસ મથકે કારચાલક વિરુદ્ધ નોંધાતાં આગળની તપાસ ડુંગરી પોલીસ કરી રહી છે.

SHASHIJIT INFRAPROJECTS LIMITED
 CIN: 1452016G2007PLC052114
 Registered Office: Plot No. 23, 2nd Floor, Girmar Khushboo Plaza, GIDC, Vapi-396195, Gujarat, India.
 Tel. No. 0262-2432963
 W: www.shashijitinfraprojects.com
 E: info@shashijitinfraprojects.com

૧૩ મી વાર્ષિક સામાન્ય સભા ની સૂચના

૧. અહીં સૂચના આપવામાં આવી છે કે કંપનીની ૧૩ મી વાર્ષિક સામાન્ય સભા કંપની અધિનિયમ, ૨૦૧૩ ની તમામ લાગુ જોગવાઈઓ અને તે હેઠળના નિયમો અને સેબી (લિસ્ટિંગ ઓબિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર્સ જર્નલ)ના રેગ્યુલેશન્સ, ૨૦૧૬, સહિત સામાન્ય પરિચય નંબર ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦ અને ૨૦/૨૦૨૦ અનુક્રમે તા. ૮ એપ્રિલ ૨૦૨૦, ૧૩ એપ્રિલ ૨૦૨૦ અને ૨ મે ૨૦૨૦ ના રોજ કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ) દ્વારા જારી કરવામાં આવેલા તથા ભારતીય પ્રતિષ્ઠિતિ અને વિનિયમ બોર્ડ દ્વારા તા. ૧૨ મે ૨૦૨૦ ના રોજ જારી કરવામાં આવેલા પરિચય નં. SEBI/MO/CFD/CMD1/CIR/P/2020/79 (સેબી પરિચય) ના અનુસંધાન સામાન્ય સ્થળે સભ્યોની ભૌતિક હાજરી વિના બુધવારે, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ બપોરે ૦૧:૩૦ વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ (VC) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ મીન્સ (OAVM) સુવિધા દ્વારા, એજુએમન્ટ સૂચનામાં દર્શાવેલ મુજબ વ્યવસાયનો વ્યવહાર કરવા યોજાશે. વીસી / ઓએવીએમ સુવિધા દ્વારા ભાગ લેનારા સભ્યોની ગણતરી કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૩ અંતર્ગત કોમ્પાઈન ગણતરીના હેતુ માટે કરવામાં આવશે.

૨. સભ્યોને પરિચયોના પાલનમાં, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે એજુએમન્ટ નોટિસ અને વાર્ષિક અહેવાલ ફક્ત તે જ સભ્યોને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે, જેમના ઇમેઇલ આઈડી કંપની / ડિપોઝિટરી સહભાગી (ઓ) સાથે નોંધાયેલા છે. એજુએમન્ટ સૂચના કંપનીની વેબસાઇટ www.shashijitinfraprojects.com પર અને BSE ની વેબસાઇટ www.bseindia.com પર અને CDSL ની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

૩. ઇમેઇલ સરનામાંની નોંધણી / અપડેટ કરવાની રીત: ડીમેટ મોડમાં શેર ધરાવતા સભ્યો, જેમણે ડિપોઝિટરી સહભાગીઓ સાથે તેમના ઇમેઇલ સરનામાંનો નોંધણી / અપડેટ કર્યો નથી, તેઓને ડિપોઝિટરી સહભાગીઓ સાથે તેમના ઇમેઇલ સરનામાં નોંધણી / અપડેટ કરવા વિનંતી છે જેની સાથે તેઓ તેમના ડિમેટ એકાઉન્ટ્સ જાળવે છે.

૪. ઈ-મતદાન દ્વારા મતદાન કરવાની રીત: a) સભ્યોને ઇ-મતદાન દ્વારા એજુએમન્ટ સૂચનામાં નિર્ધારિત ધંધા પર પોતાનો મત (ઓ) આપવાની તક મળશે. b) જે સભ્યોએ તેમના ઇમેઇલ સરનામાં રજીસ્ટર કર્યા નથી તેઓ દ્વારા ઇ-મતદાન કરવાની રીત એજુએમન્ટ સૂચનામાં આપવામાં આવી છે. c) ઇલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી દ્વારા મતદાન માટેની સુવિધા એજુએમન્ટમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે અને રિમોટ ઇ-મતદાન દ્વારા પોતાનો મત ન આપનારા એજુએમન્ટ હાજર રહેવા સભ્યો ઇ-મતદાન દ્વારા એજુએમન્ટમાં મત આપી શકશે. d) ઈ-વોટિંગ દ્વારા મત આપવા માટે લોગીન વિગતો ઇમેઇલ દ્વારા સભ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. એવા સભ્યો કે જેમને ઇમેઇલ પ્રાપ્ત થતી નથી અથવા જેમના ઇમેઇલ સરનામાં કંપની / ડિપોઝિટરી સહભાગી (ઓ) સાથે નોંધાયેલા નથી, તેઓ એજુએમન્ટ સૂચનામાં આપેલા સૂચનોને અનુસરીને લોગીન વિગતો ઉત્પન્ન કરી શકે છે. e) એ જ લોગીન વિગતોનો ઉપયોગ વીસી / ઓએવીએમ દ્વારા એજુએમન્ટમાં ભાગ લેવા માટે પણ થઈ શકે છે.

૫. એજુએમન્ટ અને ઇ-મતદાનમાં ભાગ લેવાના હેતુથી સભ્યોની ગણતરી માટેની છેલ્લી તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ છે.

૬. સભ્યોને એજુએમન્ટ નોટિસમાં નિર્ધારિત તમામ નોંધોને કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવી છે. એજુએમન્ટ જોડાવા માટેની સૂચના, રિમોટ ઈ-વોટિંગ દ્વારા અને એજુએમન્ટ દરમિયાન ઇ-વોટિંગ દ્વારા પોતાનો મત આપવાની રીત એમસીએ પરિચય / સેબી પરિચયનું પાલન કરીને આપવામાં આવી છે.

બોર્ડના ઓફિસ દ્વારા

તારીખ: ૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ શશીજીત ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ માટે

સ્થળ: વાપી SD/-

મંથન ડી.શાહ

COMPANY SECRETARY & COMPLIANCE OFFICER

FSC
FUTURE SUPPLY CHAIN SOLUTIONS LIMITED
Regd. Off.: Knowledge House, Shyam Nagar, Jogeshwari - Western Link Road, Goregaon (East), Mumbai - 400002.
Tel. No.: +91 22 6644 2200; Fax No.: +91 22 6644 2201
Website: www.futuresupplychains.com; E-mail: investor@futuresupplychains.com

NOTICE

Pursuant to regulation 47(1) read with regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Friday, 11th September 2020 *inter-alia*, to consider and approve the un-audited financial results for the quarter ended 30th June 2020.

Further details regarding the above meeting shall also be available on the Company's website www.futuresupplychains.com and on the website of the stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com.

For Future Supply Chain Solutions Limited
Sd/-
Vimal K Dhruve
Company Secretary

Place: Mumbai
Date: 5th September 2020

MANSOON TRADING COMPANY LIMITED
CIN - L99999MH1985PLC035905
Regd Office: Commerce House, 4th Floor, 3 Currimbhoy Road, Ballard Estate, Mumbai 400 001
Website: www.mansoontrading.com; Email Id: mansoontradingtd@gmail.com

NOTICE

NOTICE is hereby given that the 35th Annual General Meeting of the Members of the Company will be held at the Registered Office of the Company at Commerce House, 4th Floor, 3, Currimbhoy Road, Ballard Estate, Mumbai 400 001 on Wednesday, 30th September, 2019 at 2.30 pm.

The Annual Report for the financial year 2019-20 including the Notice convening this Annual General Meeting has been sent to the members at their registered address by post / courier and electronically to those members who have registered their email id with the Company. The Book Closure date is Wednesday, September 23, 2020 to Tuesday, September 30, 2020 (both days inclusive).

A person whose name appears on Register of Members / Beneficial Owners as on 23rd September, 2020 (Cut off date) only shall be allowed to avail the facility of remote e-voting / Voting at the meeting. The attendance slip will be provided at the venue of 35th AGM.

By order of the Board of Directors
For MANSOON TRADING COMPANY LIMITED
Sd/-
P. K. Jajodia
Director
(DIN - 00376220)

Place: Mumbai
Date: September 5, 2020

M/s. COLINZ LABORATORIES LIMITED
(CIN: L24200MH1986PLC041128)
Registered office: A-101, Pratik Industrial Estate, Mulund Goregaon Link Road, Bhandup (W), Mumbai-400078

Notice is hereby given that the Thirty Fourth (34th) Annual General Meeting (AGM) of the members of M/s. COLINZ LABORATORIES LIMITED ("the Company") will be held on **Wednesday, 30th September, 2020, at 2.30 P.M. (IST)** through Video Conferencing or Other Audio Video Means (OAVM) to transact the business as set out in the Notice of AGM.

The Notice of the AGM with Annual Report for FY 2019-20 has already been sent by email to all shareholders. The said Notice is also available on Company's website www.colinz-cl-ltd.in and also on the website of BSE at www.bseindia.com. The Company is providing remote e-voting facility as per the dates specified in the Notice of the AGM as well as e-voting during AGM and the detailed procedure of e-voting is given in the Notice of the AGM.

Pursuant to Regulation 42 of a SEBI (LODR), 2015, and such other applicable provisions, the Register of Member and Share Transfer Books of the Company will remain closed from **Wednesday, 23rd September, 2020 to Wednesday, 30th September, 2020 (both days inclusive)**.

The Notice is being issued for the information of all members of the Company.

Yours Faithfully,
By the order of Board of Directors
Dr. Mani L. S.
Mumbai: Director- Legal, Company Secretary & Compliance Officer
5th September, 2020 Din No. 00825886

Chromatic India Limited
Registered Office: 207, Vardhaman Complex Premises Co.op.Soc.Ltd., L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400083.
CIN: L99999MH1987PLC044447 | Email: chromatic@mnln.net.in | Tel: 022 22875661, Fax 022 25793973 | Website: www.chromatic.in

NOTICE OF THE 33RD ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VC/OAVM

NOTICE is hereby given that the Thirty Third Annual General Meeting (AGM) of the Company will be held on Tuesday, September 29, 2020 at 11.00 a.m. through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM") without physical presence of members at a common venue in compliance with applicable provisions of the Companies Act, 2013, the General Circular No. 14/2020 dated April 08, 2020, No. 17/2020 dated April 13, 2020 and No. 20/2020 dated May 05, 2020 issued by Ministry of Corporate Affairs ("MCA Circulars") and circular issued by the Securities and Exchange Board of India dated May 12, 2020 ("SEBI Circular"), to transact the business as set out in the Notice of the 33rd AGM sent along with Explanatory Statement, Directors Report, Auditors Report and the Audited Standalone and Consolidated Financial Statements of the Company for the year ended March 31, 2020.

In compliance with the above circulars, electronic copies of the Notice of the AGM along with the procedure and instructions for evoting and attending the meeting through VC/OAVM and Annual Report for year 2019-20 has been sent on September 05, 2020 to all the shareholders whose email IDs are registered with the Company / Depositories / the Company's Registrar and Share Transfer Agent i.e. M/s. Bigshare Services Private Limited. Shareholders holding shares in dematerialized mode, are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants or by writing to M/s. Bigshare Services Private Limited at investor@bigshareonline.com.

Shareholders holding shares in physical mode are requested to furnish their email addresses and mobile numbers with registered with the Company / Depository Participant (s). Shareholders holding shares in dematerialized mode, are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants. Shareholders holding shares in physical mode are requested to furnish their email addresses and mobile numbers with the Company's Registrar and Share Transfer Agent i.e. M/s. Bigshare Services Private Limited at investor@bigshareonline.com.

The Notice of the 33rd Annual Report for the year 2019-20 will be made available on the Company's website i.e. www.chromatic.in, on the website of BSE Limited i.e. www.bseindia.com and National Stock Exchange of India i.e. www.nseindia.com and on the website of the CDSL's website i.e. www.evotingindia.com.

Pursuant to Section 91 and other applicable provisions, if any, of the Companies Act, 2013 and the Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, 25 September, 2020 to Tuesday, 29 September, 2020 (both days inclusive) for the purposes of this 33rd Annual General Meeting.

In terms of Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as substituted by the Companies (Management and Administration) Amendment Rules, 2015 (Amended Rules 2015) and the provisions of the Listing Regulations, Members are provided with the facility to cast their vote on all resolutions set forth in the Notice of the 33rd AGM using electronic voting system from a place other than the venue of the AGM (remote e-voting), provided by Central Depository Services (India) Limited (CDSL) and the business may be transacted through such voting. Further note that members who have voted by e-voting services cannot vote at the AGM.

Members holding shares either in physical or in demat mode as on the cut-off date i.e., Monday, 21 September, 2020 may cast their votes electronically on the businesses set out in the Notice of the 33rd AGM. The e-voting shall commence from Saturday, 26 September, 2020 at 9:00 A.M. and ends on Monday, 28 September, 2020 at 5:00 P.M. (both days inclusive). Once the vote on a resolution is cast by the shareholder, the shareholder shall not be allowed to change it subsequently.

The voting rights of the members shall be in proportion of the equity shares held by them in the paid up equity share capital of the Company as on the cut-off date i.e. Monday, 21 September, 2020 and they shall be entitled to avail the facility of remote e-voting and vote at the AGM.

Any person who becomes a member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Monday, 21 September, 2020, may obtain the User ID and password by writing a request at evoting@cdsindia.com. However, if you are already registered with CDSL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote. If you forget your password, you can reset your password by using "Forgot User Details / Password" option available on www.evotingindia.com.

Members may note that: (i) the remote e-voting module shall be disabled by (CDSL) at 5:00 p.m. on Monday, 28 September, 2020 and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; (ii) Since the 33rd AGM will be convened through VC/ OAVM, the facility for voting through physical ballot paper will not be made available, however members may cast their vote through e-voting which will be made available at the time of the AGM; (iii) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM through VC/ OAVM but shall not cast their vote again; (iv) a person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail facility of remote e-voting as well as e-voting at the time of AGM.

Mr. Dharmesh Sarvaiya, Practicing Company Secretaries, has been appointed by the Board of Directors of the Company as Scrutinizer for scrutinizing the remote e-voting processes as well as voting at the meeting in a fair and transparent manner.

If you have any queries or issues regarding attending AGM & e-voting from the e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdsindia.com or contact Mr. Nilin Kunder (022- 23058738) or Mr. Mehboob Lakhani (022-23058543) or Mr. Rakesh Dalvi (022-23058542).

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futrex, Malafall Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdsindia.com or call on 022-23058542/43.

By order of the Board of Directors
For Chromatic India Limited
Sd/-
Vinod Kumar Kaushik
Whole-time Director

Place: Mumbai
Date: September 5, 2020

PUBLIC NOTICE

Notice is hereby given to the Public that Nehru Nagar Saubhaga CHSL, is the Society situated at the ALL That piece and parcel of land or ground bearing the property situated at Building No. 129, on plot bearing CTS no. 2 (pt.) at village Kuria - III, Nehru nagar, MHADA Layout, at Kuria (East), Mumbai - 400 024 along with the building structure standing thereon known as "Nehru Nagar Saubhaga Co-op. Hsg. Soc. Ltd." at Building No. 129, Nehru nagar, Kuria (East), Mumbai - 400 024, (hereinafter referred as said Society) The above said Society have entered into the Development Agreement, and all Agreement, Deeds relating thereto with M/s. Satyadeep Realtors Pvt. Ltd.

Any person or persons having any sort of objections in said respect that the abovesaid society had entered the Development Agreement and all Agreement, Deeds relating thereto, with M/s. Satyadeep Realtors Pvt. Ltd., then Contact me in writing at under mentioned address within 7 days from the day of Publication of this Notice otherwise "NO OBJECTION" shall not be entertained.

505, 5th Floor, Ecstasy Business Park, City of Joy, JSD Road, Mulund (West), Mumbai-400 080.

Mumbai-400 080
Date - 04.09.2020

Sd/-
Manoj C. Mane
Advocate

Trejhora
Trejhora Solutions Limited
Regd. Office: Unit No. 601, Sigma IT Park, Plot No. R-203, R-204 T.T.C. Industrial Estate, Rabale Navi Mumbai - 400701.
CIN: L72900MH2017PLC292340
Phone: +91-22-4040 8080 Fax: +91 22-4040 8081
Email: investor@trejhora.com Website: www.trejhora.com

NOTICE

Notice is hereby given, pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a Meeting of the Board of Directors of the Company will be held on Monday 14th September, 2020 to consider and approve unaudited (Standalone & Consolidated) Financial Results for the quarter ended 30th June, 2020. The said information would be available at website at www.trejhora.com and would also be available at website of stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com

For Trejhora Solutions Limited
Sd/-
Nilesh Kharche
Company Secretary

Place: Navi Mumbai
Date: 5th September, 2020

PUNJAB NATIONAL BANK
(A Govt. of India Undertaking)
Circle SASTRA, Mumbai Western
Aman Chambers, Veer Savarkar Marg, Prabhavevi, Mumbai - 400 025.
E-mail: cs4444@pnb.co.in

POSSESSION NOTICE.
Under Rule 8(1)

WHEREAS
The undersigned being the Authorized Officer of the Punjab National Bank, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (54 of 2002) and in exercise of powers conferred under Sec 13(12), read with Rule 9 of the Security Interest (Enforcement) Rules 2002 issued Demand Notice dated 18/09/2019 calling upon the borrower **M/s. Kiran Vinay Shah & Ms. Nehal Vinay Shah** to repay the amount mentioned in the said notice being **Rs.22,04,422.45 (Rupees Twenty Two Lac Four thousand Four hundred Twenty Two and Paise Forty Five only)** as on 03/09/2019 plus interests and charges thereupon within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to pay the amount, NOTICE is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described in the SCHEDULE hereunder in exercise of powers conferred on me under Sec 13(4) of the said Act read with Rule 9 of the said Enforcement Rules on this **2nd day of September of Year 2020**.

The Borrower / Mortgagee / Guarantor / proprietor and the public in general are hereby cautioned not to deal with the Property/properties more fully described in SCHEDULE hereunder and any dealings with the property/properties mentioned below will be subject to the charge/mortgage of the Punjab National Bank for an amount **Rs.22,04,422.45 (Rupees Twenty Two Lac Four thousand Four hundred Twenty Two and Paise Forty Five only)** as on 03/09/2019 plus interests and charges thereupon besides the costs of publication and other legal expenses consequential and incidental thereto.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

SCHEDULE: Details of Secured Asset /Mortgaged property:

Sr No	Details of Securities
1	Flat No504, C Wing, Veena Enclave CHSL, Mangal Nagar, Halkesh Ghodbunder, Meera Bhayander Road, Meera Road (East), Thane - 401107 standing in the name of M/s. Kiran Vinay Shah & Ms. Nehal Vinay Shah

Dated: 02/09/2020
Place: Mumbai

Sd/-
AUTHORISED OFFICER
A.Ramachandran,
Chief Manager.

SHASHIJIT INFRAPROJECTS LIMITED
Registered office: Plot No. 209, Shop No. 23, 2nd Floor, Girnar Khushboo Plaza, GIDC, Vapi-396195, Gujarat, India.
Tel. No. 0260-2432963
W: www.shashijitinfraprojects.com
E: info@shashijitinfraprojects.com

NOTICE OF THE 13th ANNUAL GENERAL MEETING

1. Notice is hereby given that the 13th Annual General Meeting (AGM) of the Company will be held on Wednesday, 30th September, 2020, at 01.30 pm, through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM) facility in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated 8th April 2020, 13th April 2020 and 5th May 2020 respectively issued by Ministry of Corporate Affairs (MCA) and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May 2020 (SEBI Circular) issued by Security and Exchange Board of India, without the physical presence of the Members at a common venue, to transact the business set out in the Notice Calling the AGM. Members participating through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

2. In compliance with the relevant circulars, the Notice of the AGM and Annual Report for the FY 2019-20 will be sent only by E-Mail to all those Members whose E-Mail IDs are registered with the Company/Depository Participant(s). The aforesaid documents will be made available on the website of the Company at www.shashijitinfraprojects.com and at BSE's website www.bseindia.com and also at CDSL's website www.evotingindia.com.

3. **Manner of Registering/Updating E-Mail Address:**
Members holding shares in Dematerialised mode, who have not registered/updated their e-mail addresses with the Depository Participants, are requested to register/update their E-Mail addresses with the Depository Participants with whom they maintain their demat accounts.

4. **Manner of casting vote(s) through e-voting:**

- Members will have an opportunity to cast their vote(s) on the business set out in the Notice of the AGM through E-Voting.
- The manner of voting Remotely by members who have not registered their E-Mail addresses has been provided in the Notice of the AGM.
- The facility for voting through electronic voting system will also be made available at the AGM and members attending the AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM through E-Voting.
- The login credentials for casting votes through e-voting shall be made available to the members through e-mail. Members who do not receive email or whose email addresses are not registered with the Company/Depository Participant(s), may generate login credentials by following instructions given in the notice of the AGM.
- The same login credentials may also be used for attending the AGM through VC/OAVM.

5. cut-off date for reckoning the members for the purpose of attending the AGM and e-voting is September 19, 2020.

6. Members are requested to carefully read all the notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting their vote through remote e-voting and through e-voting during the AGM in compliance with the MCA Circulars and the SEBI Circular.

By Order of the Board
For SHASHIJIT INFRAPROJECTS LIMITED
Sd/-
Manthan D. Shah
Company Secretary & Compliance Officer

Dated: 6th September, 2020
Place: Vapi

मराठी मनाव आवाज
नवशक्ति
www.navshakti.co.in
किंमत ३ रुपये

The Company of Master Mariners of India

K.Raheja Prime, 5th Floor, Sag Baug Road, Marol Industrial Estate, Off Andheri Kuria Road, Marol, Andheri (East), Mumbai 400 059
Tel: +91 88550 52666, E-mail: office@cmml.co.in, Website: www.cmml.co.in

PUBLIC NOTICE- 63rd ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the Sixty Third Annual General Meeting (AGM) of the Company of Master Mariners of India (CMMI) will be convened on Tuesday, the 29th September 2020 at 1800 hours (IST) through video conferencing (VC)/Other Audio Visual Means (OAVM).

The Notice of the Meeting setting out the business to be transacted together with the Audited Financial Statements, Report of the Board of Directors and the Auditors thereon for the financial year ended 31st March 2020 (collectively the Annual Report) will be sent through electronic mode to those members who have registered their email IDs with the Company in accordance with the Circular No.20/2020 dated 5th May, 2020 read with Circular No.14/2020 dated 8th April, 2020, Circular No.17/2020 dated 13th April, 2020 issued by the Ministry of Corporate Affairs (MCA Circulars).

The Notice and the Annual Report has been uploaded on the website of the Company at www.cmml.co.in. The procedure of joining the AGM through VC/OAVM is mentioned in the Notice.

Members can attend and participate in the AGM through VC/OAVM facility ONLY, the details of which will be provided by the Company in the Notice of the meeting. Accordingly please note that no provision has been made to attend the AGM in person.

The attendance of Members participating in the AGM through VC/OAVM will be counted for the purpose of ascertaining the quorum under Sec 103 of the Act.

Members who need any technical assistance before or during the AGM can contact Capt. Sasikumar S., CEO, CMML, Mobile no. 98218 39084, E-mail: ceo@cmml.co.in

Winmore Leasing And Holdings Limited
Regd. Off.: Ashiana 69-C, Bhulabhai Desai Road, Mumbai - 400 026
Tel. No.: 022-2686618 E-mail: ho@hawcolindia.com
CIN No.: L67120MH1984PLC727432
Website: www.winmoreleasingandholdings.com

Notice is hereby given that the 36th Annual General Meeting (AGM) of the Company will be held at Gate No. 10, 1st Floor, Brabourne Stadium, 87, Veer Nariman Road, Mumbai 400 020 on Tuesday, 29th September, 2020 at 10.30 a.m. to transact the business as set forth in the Notice of the Meeting dated 2nd September, 2020.

The Company provides its members the facility to cast their votes by electronic means on all resolutions set forth in the Notice.

- Date and time of commencement of remote e-voting: 25th September, 2020 (9.00 a.m. IST)
- Date and time of end of remote e-voting: 28th September, 2020 (5.00 p.m. IST)
*Remote e-voting shall not be allowed beyond 5.00 p.m.
- Cut off date: 23rd September, 2020
- Members holding shares on the cut-off date shall be entitled to avail facility of remote e-voting or voting through ballot paper by the AGM.
- Members who have cast their vote by remote e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again.
- Annual Report of the Company for the FY 2019-2020 along with Notice of the AGM containing procedure for remote e-voting is also available on the websites of the Company at www.winmoreleasingandholdings.com and of NSDL at www.evoting.nsdl.com and of Metropolitan Stock Exchange of India Ltd at www.msx.in.
- Any person who acquires shares and becomes a member of the Company after dispatch of the Annual Report by the Company and holding shares as on the cut off date, may obtain his / her login id and password for remote e-voting from NSDL by sending a request at evoting@nsdl.co.in.

Register of Members and Share Transfer Books of the Company will remain closed from 28th September, 2020 to 29th September, 2020.

In case of any queries related to remote e-voting, members may refer the FAQs and remote e-voting user manual available at the downloads section of www.evoting.nsdl.com or call on toll free no.:1800-222-990 or send a request at evoting@nsdl.co.in. Members may also contact Ms Pallavi Mhatre, Manager, at telephone no.: 022-24994545, who will also address grievances pertaining to remote e-voting.

HINDOOSTAN MILLS LIMITED
CIN : L17121MH1904PLC195
Registered & Admn. Off.: Sir Vithaldas Chambers, 16, Mumbai Samachar Marg, Mumbai-400 001.
Phone : 22040846 Fax: 22833841
Email : contact@hindoostan.com Website : www.hindoostan.com

NOTICE OF THE 116th ANNUAL GENERAL MEETING BOOK CLOSURE AND E-VOTING INFORMATION
116th ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 116th Annual General Meeting (AGM) of the Members of Hindoostan Mills Limited (the Company) will be held on Tuesday, September 29, 2020 at 12.00 Noon through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM").

The AGM will be held only through VC/OAVM in compliance with the provisions of the Companies Act, 2013 and circulars dated 5th May 2020, 13th April 2020 and 8th April 2020 issued by Ministry of Corporate Affairs and SEBI Circular dated 12th May 2020 (Circulars). Facility for appointment of proxy will not be available for the AGM. The instructions for joining the AGM electronically are mentioned in the Notice of AGM.

In compliance with the circulars, the Notice setting out the business to be transacted at the AGM along with an Explanatory Statement pursuant to Section 102(1) of the Companies Act, 2013 and the Annual Report of the Company for the financial year 2019-20 have been sent in electronic mode on September 03, 2020 to the Members whose e-mail IDs are registered with the Company/Depository Participants for communication purpose. These documents are also available on the Company's website i.e., www.hindoostan.com and also on the web site of stock exchange at www.bseindia.com.

Members holding shares in physical mode and who have not updated their email addresses requested to update their email addresses by writing to the Company's Registrar and Transfer Agent, Computech Sharecap Limited at helpdesk@computechsharecap.in

Members holding shares in dematerialised mode are requested to register / update their email addresses with the relevant Depository Participants.

Members holding shares in physical mode/dematerialised mode, as on cut-off date i.e. Tuesday, September 22, 2020, may cast their votes electronically on the business set out in the Notice of AGM.

Members are hereby informed-

- The Company has completed sending of Annual Report & Notice of AGM on **Thursday, September 03, 2020** through electronically.
- Remote e-voting will commence on **Friday, September 25, 2020 (9:00 am)** and ends on **Monday, September 28, 2020 (5:00 pm)** and e-voting shall not be allowed beyond the said time and date;
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system at the AGM shall be **Tuesday, September 22, 2020**;
- The voting rights of members shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as on the Cut Off date of **Tuesday, September 22, 2020**;
- Any person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the notice through electronically and holds shares as on cut-off date i.e. on **Tuesday, September 22, 2020**, may obtain the login ID and password by sending a request at the Company/Registrar & Transfer Agent. However, if you are already registered with CDSL for remote e-voting then you can use your existing user ID and password for casting your vote.
- A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM;
- Book Closure:** Notice is further given that pursuant to Section 91 of the Act and the Rules framed thereunder, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from **Friday, September 25, 2020 to Tuesday, September 29, 2020** (both days inclusive) for the purpose of 116th Annual General Meeting.
- The members who have cast their vote by remote e-voting prior to the General meeting may also attend the General meeting but shall not be entitled to cast their vote again.
- In case of any queries regarding e-voting, members may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdsindia.com.

By Order of the Board of Directors,
For HINDOOSTAN MILLS LIMITED
Sd/-
KAUSHIK KAPASI
Company Secretary

Place: Mumbai
Date: September 03, 2020

SYMBOLIC POSSESSION NOTICE

ICICI Bank
Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra- 400604

Whereas
The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand (Rs.)	Name of Branch
1.	Dharmendra Umakant Sheth/ Radhika Dharmendra Sheth- LBTRNE00002467817 LBUM000002136808	Flat No 402, 4th Flr, Bldg No Ec-103, Aries CHSL, Survey No. Old 203 New 266, Village Achole, Situated At Everehing City Avenue, Sectorral, Vasai (E), Tal. Vasai, Dist. Thane, Within The Area Of Sub Registrar Of Assurances At Vasai- III, Nalasopara/ September 02, 2020	September 30, 2019 Rs. 13,02,833.00/-	Thane
2.	Ritesh Gopalprasad Gupta & Rakesh G Gupta- LBTRNE00004095439 LBUM000004095160	Flat No 1206, 12th Floor, Bldg No 1, Wing B, Survey No 212, Hissa No 2, Prithvi Residency, Virar Nallasopara Link Road, Near Yashwant Gaurav, Nilemore, Nallasopara (W), Taluka Vasai, District Palghar- 401208/ September 02, 2020	October 31, 2019 Rs. 18,63,488.00/-	Mumbai
3.	Udaya Kumar S Khavri & Seema Uday Khavri- LBUM000002252404 LBVRR000002975320	Flat No 305, 3rd Flr, D Wing, "Mahalaxmi Apartment", Situated At Village Agashi, Near Purandappa Stop, H.R., 0-21-85 Out of Survey No.21, (Survey No.21, 22: Hissa No: 5.1) Virar West Thane- 401303/ September 02, 2020	January 28, 2020 Rs. 16,13,014.00/-	Mumbai
4.	Neeraj K Kohli & Sakshi Neeraj Kohli- LBUM00002002384	Flat No. 301, 3rd Floor, Building No. 1, Krishna Horizonte-1, S. No. 242, B/H Fun Fiesta, Nallasopara West, Thane, Maharashtra- 401210/ September 02, 2020	November 30, 2019 Rs. 7,73,334.00/-	Mumbai

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Dated: 05-09-2020
Place: Mumbai

Authorized Officer
ICICI Bank Limited

PLASTIBLENDS INDIA LIMITED
CIN : L25200MH1991PLC059943
Regd. Office : Fortune Terraces, 'A' Wing, 10th Floor, Opp. Citi Mall, New Link Road, Andheri (West), Mumbai - 400053, Maharashtra, India.
Tel:-+91 22-26736468/9 | Fax: +91 22-26736808 | Email:pbi@kolisitegroup.com | Website:www.plastibleninds.com

INFORMATION REGARDING 29th ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 29th Annual General Meeting (AGM) of the Company will be held through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") on Wednesday, September 30, 2020 at 03:30 p.m., in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circular Nos. 14/2020, 17/2020 and 20/2020 dated April 08, 2020, April 13, 2020 and May 05, 2020 respectively, and other applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 (collectively referred to as "relevant circulars"), to transact the business set out in the Notice calling the AGM.

The Notice of the AGM and the Annual Report for the financial year 2019-20, will be sent only electronically to all the Members of the Company whose email addresses are registered with the Company / Depository Participant(s). The aforesaid documents will also be available on the Company's website at www.plastibleninds.com and on the website of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com.

The Company is providing the remote e-voting facility as well as e-voting facility during the meeting. The detailed procedure for remote e-voting / e-voting for Shareholders holding shares in dematerialized mode, physical mode and for Shareholders who have not registered their e-mail addresses will be provided in the Notice of AGM. The same login credentials may also be used for attending the AGM through VC / OAVM. Members are requested to register / update their email addresses and/or complete bank details for receiving Dividend:

- with their Depository Participant(s) with whom they maintain their demat accounts, if shares are held in dematerialised mode by submitting the requisite documents.
- with the Company / Registrar & Share Transfer Agent, if shares are held in physical mode, by sending a scanned copy of signed request letter at pbi_sd@kolisitegroup.com / support@sharexindia.com mentioning member's name and folio number for updating email address and bank details (Bank account number, Bank and Branch Name and address, IFSC, MICR), along with self-attested copy of cancelled cheque leaf for updating their bank details.

For Plastibleninds India Limited
Sd/-
Himanshu Mhatre
Company Secretary

Date :- September 05, 2020
Place :- Mumbai

D & H India Ltd.
CIN: L28900MH1985PLC035822
Regd. Office: A-204, Kailash Esplanade, Opp. Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai-400086
Telfax: +91(22)25006441 Website: www.dnhindia.com Email: ho@dnhindia.com

NOTICE OF 35th AGM, E-VOTING AND BOOK CLOSURE

1. ANNUAL GENERAL MEETING (AGM):
NOTICE is hereby given that the 35th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on **30th day,**